



સાબરમતી પોલીસ સ્ટેશન
અમદાવાદ શહેર
ફોન નંબર : ૦૭૯-૨૭૫૦૬૮૧૯



પ્રેસનોટ

બે મો.સા. ચોરીના ગુનાઓનો શોધી કાઢતી સાબરમતી પોલીસ

માનનીય પોલીસ કમિશ્નર શ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર ૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૨ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી "એલ" ડિવિઝન અમદાવાદ શહેર નાઓ તરફથી મિલકત સંબંધી ગુના રોકવા તેમજ બનેલ ગુનાઓ શોધવા સારૂ સુચના આપેલ હોય જે સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.એચ.વાળા સાબરમતી પો.સ્ટે. નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ સર્વે સ્કોર્ડ પો.સબ.ઇન્સ. શ્રી ડી.જી.બડવા તથા મ.સ.ઇ. રામમોહન ધરમસિંહ બ.નં-૮૧૪૨ તથા પો.કો. કમલેશકુમાર સોમાભાઇ બ.નં-૫૭૧૧, તથા પો.કો. હિતેષકુમાર નાગજીભાઇ બ.નં-૧૩૨૧૪ તથા પો.કો. જયેશકુમાર બાબુલાલ બ.નં.-૧૦૧૧૪ તથા લોકરક્ષક ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ બ.નં-૧૦૭૦ તેમજ બીજા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે "એક ઇસમ જેણે શરીરે ગુલાબી જેવા કલરનો શર્ટ જેમા કુલ દોરેલ છે તથા જે જીન્સ પેન્ટ પહેરેલ છે જે ઇસમ સાબરમતી જનપથ ટોલનાકા તરફથી આવી પાવરહાઉસ તરફ પોતાની પાસે એક મો.સા. નંબર GJ-01-JK-6687 નુ લઇ અત્રેથી પસાર થનાર છે" વિગેરે બાતમી હકીકત આધારે સાથેના સ્ટાફના માણસો તેમજ પંચોને સાથે રાખી હકીકતવાળી જગ્યાએ વોચ દરમ્યાન ઉપરોક્ત હકીકતવાળો ઇસમ નામે ભુપતજી સ્વરૂપજી ઠાકોર એક હીરો હોંડા કંપનીનુ સ્પેન્ડર પ્લસ કાળા કલરનું વાદળી સિલ્વર કલરના પદ્મવાળુ મો.સા. જેનો આર.ટી.ઓ. નંબર જોતાં GJ-01-JK-6687 નો છે તેમજ એન્જીન નંબર જોતાં HA10EA89D30572 જેવો વંચાય છે તથા ચેસીસ નંબર જોતાં MBLHA10EE89D26080 જેવો વંચાય છે જેની કિ.રૂ.૨૫,૦૦૦/- ની મતાનુ સાથે મળી આવતાં તેને અટક કરી મો.સા. સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે લીધેલ છે અને સદર મો.સા. બાબતે તપાસ કરતાં અત્રેના પો.સ્ટે.માં ફસ્ટ ગુના રજી.નં-૧૨૮/૨૦૧૯ ઇ.પી.કો. ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરી થયેલ મો.સા. હોવાનું જણાઈ આવેલ. તેમજ સદરીની વધુ પુછપરછ દરમ્યાન બીજા બે મો.સા મળી આવેલ જેમા એક હીરો કંપનીનું સ્પેન્ડર પ્લસ કાળા કલરનું સિલ્વર કલરના પદ્મવાળુ મો.સા. જેનો આર.ટી.ઓ. નંબર જોતાં GJ-01-PR-5109 નો છે તેમજ એન્જીન નંબર જોતાં HA10EJDHG42491 જેવો વંચાય છે તથા ચેસીસ નંબર જોતાં MBLHA10AMDHG41784 જેવો વંચાય છે જેની કિ.રૂ.૩૦,૦૦૦/- ગણાય જે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે લીધેલ છે અને સદર મો.સા. બાબતે તપાસ કરતાં રાણીપ પો.સ્ટે.માં ફસ્ટ ગુના રજી.નં-૪૨/૨૦૧૯ ઇ.પી.કો. ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરી થયેલ મો.સા. હોવાનું જણાઈ આવેલ તેમજ ત્રીજા મળી આવેલ હીરો હોંડા સ્પેન્ડર મો.સા. નંબર GJ-01-BD-5352 બાબતે હાલમાં આગળની વધુ તપાસ પો.સબ.ઇન્સ. શ્રી ડી.જી.બડવા નાઓ ચલાવી રહેલ છે.

આમ અમદાવાદ શહેર પોલીસને વાહન ચોરીના બે ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

તા.૨૧-૦૮-૨૦૧૯

